

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં જુલાઈ 2 થી બસમાં ભાડું ચૂકવણી અને આગળના દરવાજાથી પ્રવેશ ફરીથી શરૂ કરવામાં આવશે, અને નોન-મેડિકલ માસ્ક્સ પહેરવા અનિવાર્ય બનશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 3, 2020) – આજે, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સીટી ઓફ બ્રેમ્પટનના રિઓર્પનીંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે સંખ્યાબંધ પગલાઓની ઘોષણા કરી. ગુરુવાર, જુલાઈ 2 થી, ભાડું ચૂકવણી અને બસમાં આગળથી પ્રવેશ ફરીથી શરૂ કરવામાં આવશે. પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની પબ્લિક ટ્રાન્ઝિટમાં માસ્ક્સ પહેરવાની કડક ભલામણને અનુસરતા, જુલાઈ 2 થી બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારુઓ અને ઓપરેટરો માટે બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માસ્ક્સ પહેરવા અનિવાર્ય બનશે.

ઉતારુઓ અને કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ અને સીટી ઓફ બ્રેમ્પટન માટે ટોચની અગ્રતા ધરાવે છે, અને તે બંનેની ખાતરી કરાવતી વખતે આ ફેરફારો અમલી બનશે.

### ભાડું ચૂકવણી

જુલાઈ 2 થી શરૂ કરીને બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બધી બસોમાં ભાડું ચૂકવવું જરૂરી બનશે. ઉતારુઓને સંપર્કરહિત ચૂકવણી સ્વરૂપે પોતાનું ભાડું ચૂકવવા પોતાના PRESTO કાર્ડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભાડાને લગતી પૂરી વિગતો માટે, [અહીં ક્લિક કરો](#).

વયોવૃદ્ધ વડીલો માટે પહોંચ યોગ્ય ટ્રાન્ઝિટ પૂરું પાડવું એ શહેર માટે ટોચની અગ્રતા છે, અને COVID-19 નાં પ્રભાવને ધ્યાનમાં લેતા, બધાં સક્રિય સીનિયર આઈડી કાર્ડની સમાપ્તિ તારીખ અચોક્કસ સમય સુધી મોકૂફ રાખવામાં આવી છે. ટ્રાન્ઝિટ ટર્મિનલ્સ પર કસ્ટમર કાઉન્ટર્સ જુલાઈ 2 પહેલાં ફરીથી ખોલવામાં આવશે. તે ઉપલબ્ધ થાય એટલે અમે અદ્યતન માહિતી પૂરી પાડીશું.

વર્ષ 2020 માટે દરખાસ્ત હેઠળના ભાડામાં ફેરફારો આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે.

### આગળના દરવાજાથી પ્રવેશ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ જુલાઈ 2 થી શરૂ કરીને બધાં ઉતારુઓને બસમાં આગળના દરવાજાથી પ્રવેશવાની છૂટ આપશે. ઉતારુઓએ પાછળના દરવાજાથી બહાર નીકળવાનું રહેશે. ઉતારુઓને એકબીજાથી બે મીટર (છ ફૂટ) દૂર રહીને ભૌતિક અંતરના પગલાઓ જાળવવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું, અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું અને છીંકવાનું યાદ અપાવે છે.

### નોન-મેડિકલ માસ્ક્સ

પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની પબ્લિક ટ્રાન્ઝિટમાં માસ્ક્સ પહેરવાની કડક ભલામણને અનુસરતા, જુલાઈ 2 થી બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારુઓ અને ઓપરેટરો માટે બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માસ્ક્સ પહેરવા અનિવાર્ય બનશે.

માસ્ક્સ પહેરવા અનિવાર્ય રહેશે ત્યારે, બે વર્ષથી નીચેના અથવા અશક્ત બાળકો કે પોતાને માસ્ક પહેરતા રોકે તેવી અન્ય તબીબી સ્થિતિઓ ધરાવતા બાળકોએ માસ્ક પહેરવા જરૂરી રહેશે નહીં.

તમારા નોન-મેડિકલ માસ્ક યોગ્ય રીતે પહેરવા, બેસાડવા, કાઢી નાખવા અને સાફ રાખવાની રીત સહિત, નોન-મેડિકલ માસ્ક્સના સંદર્ભમાં વધુ માહિતી માટે, પીલ પબ્લિક હેલ્થની [વેબસાઈટ](#) અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની [વેબસાઈટ](#) જુઓ.

**COVID-19 સુરક્ષા ઉપાયો**

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજીંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી માસ્ક પહેર્યો હોય તો પણ ઉતારુઓને બસોમાં, ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર જાળવવાનું આચરણ ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનિટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવે છે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, સીટી ઓફ બ્રેમ્પટન દરેક વ્યક્તિને નોન-મેડિકલ માસ્ક પહેરવા પ્રોત્સાહિત કરે છે, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર જાળવવું પડકારભર્યું હોઈ શકે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. નિયમિત અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ [www.brampton.ca/covid19](http://www.brampton.ca/covid19) અને [www.bramptontransit.com](http://www.bramptontransit.com) જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે ટ્વિટર પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

**અવતરણો (ક્વોટ્સ):**

“આપણે COVID-19 મહામારી દરમિયાન પોતાને અને અન્ય દરેક વ્યક્તિને સુરક્ષિત રાખવા સાથે મળીને કામ કરવાની જરૂર છે. જો તમે બ્રેમ્પટન ટ્રાન્ઝિટના ઉતારુ હો તો, હું તમને બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માસ્ક ખરીદવાની અને પહેરવાની, અને દરેક વ્યક્તિના આરોગ્ય અને સુરક્ષા માટે તમારા નોન-મેડિકલ માસ્ક યોગ્ય રીતે પહેરવા, બેસાડવા, કાઢી નાખવા અને સાફ રાખવાની રીત અંગે પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોનું માર્ગદર્શન અનુસરવાની વિનંતી કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“COVID-19 દરમિયાન રહેવાસીઓની સુરક્ષિત રીતે હેરફેર કરવી એ આપણી સીટી કાઉન્સિલ માટે અગ્રતા બાબત છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ કર્મચારીઓ અને ઉતારુઓ માટે આ વધારાના સુરક્ષા ઉપાયોથી ખાતરી કરાવે છે કે આપણે પણ ખાતરી કરાવતા રહીએ કે સીટી આપણાં શહેરના રિઓપનીંગ માટે નિર્ણાયક પગલાઓ લઈ રહ્યું છે ત્યારે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સુરક્ષિત વિકલ્પ બની રહે.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન આપણાં સમુદાય માટે આરોગ્યપ્રદ અને સુરક્ષિત ટ્રાન્ઝિટ સર્વિસ પૂરી પાડવા સમર્પિત છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ બસમાં ભાડું અને આગળના દરવાજાથી પ્રવેશ ફરીથી શરૂ કરવા, અને પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોના માર્ગદર્શન અનુસાર આરોગ્યપ્રદ અને સુરક્ષિત રીતે નોન-મેડિકલ માસ્ક્સ અનિવાર્યપણે પહેરવાનો અમલ કરવા જરૂરી તમામ પગલાઓ લઈ રહ્યું છે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ



## Media Release

કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પ્ટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)